



જનસંપર્ક અધીકારી દ્વારા
પોલીસ કમિશનરશ્રીની કચેરી, અમદાવાદ શહેર
ટેલીફોન નંબર ૨૫૬૩૩૩૩૩



કંટ્રોલરૂમ ટેલી.નં. ૨૫૬૩૦૧૦૦, ૨૫૬૩૦૨૦૦, ૨૫૬૩૦૪૦૦ ફેક્સ: ૨૫૬૩૦૬૦૦

તા.૨૨/૧૦/૨૦૧૮ સોમવાર

અમદાવાદ શહેર પોલીસ સમાચાર

નશાબંધી તથા જુગારધારા હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૨૦૬૪/૧૮

શહેર પોલીસે ગઈકાલે નશાબંધી ધારા હેઠળ ૩૩ કેસ કરી, ૩૨ વ્યક્તિઓને ઝડપી, ૨૦૭ લીટર દેશી દારૂ, ૧૧૨ બોટલ ઈંગ્લીશ દારૂ અને ૦૧ મોટર સાયકલ કબજે કર્યું હતું. તેમજ જુગાર ધારા હેઠળ ૦૬ કેસ કરી ૨૩ વ્યક્તિઓની અટક કરી રોકડ રૂપિયા ૪૪,૯૫૦/- અને જુગારના સાધનો કબજે કર્યા હતા.

તકેદારીના પગલા હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૨૦૬૫/૧૮

શહેર પોલીસે ગઈકાલે તકેદારીના પગલા હેઠળ સી.આર.પી.સી.૧૦૭,૧૦૯,૧૧૦,૧૫૧ મુજબ કુલ ૯૬ વ્યક્તિઓની અટકાયત કરી હતી. તેમજ પ્રોહી ૯૩ મુજબ ૦૪ વ્યક્તિઓની અટકાયત કરી હતી.

છેતરપીંડીની ફરીયાદ:-

સમાચાર યાદી નં.૨૦૬૬/૧૮

કાઠમ બ્રાન્ય: રજનીકાંત પુંજાલાલ શાહ (ઉ.વ.૭૨)(ધંધો: વેપાર)(રહે,લાવણ્ય સોસાયટી, વાસણા) એ તા.૨૧/૧૦/૧૮ નારોજ કાઠમ બ્રાન્ય ખાતે ફરીયાદ નોંધાવી છે કે માર્ચ/૨૦૧૫ થી આજદિન સુધીના સમયગાળા દરમ્યાન આશ્રમ રોડ બાટા શો રૂમ સામે મૂદ્દલ ટાવર ખાતે આવેલ રજનીકાંતભાઈની ઓફિસ નંબર ૨,૩,૪ ખાતે આરોપી (૧) હેમાંગ પંકજભાઈ શાહ (આરંભ પ્રોકોન પ્રા.લિ. ના મેનેજીંગ ડાયરેક્ટર) તથા (૨) પંકજભાઈ વિમલભાઈ શાહ (આરંભ પ્રોકોન પ્રા.લિ. ના એડીશનલ ડાયરેક્ટર)(ઓફિસ:- સ્વસ્તિક પ્લાઝા સરદાર પટેલ સ્ટેડીયમ પાસે નવરંગપુરા) એ ભેગામળી રજનીકાંતભાઈ સાથે ધંધાકીય વિશ્વાસ કેળવી, શરાફી વ્યાજ સહીત કુલ રૂપિયા ૧૦,૨૪,૦૮,૫૨૬/- ની છેતરપીંડી અને વિશ્વાસઘાત કર્યો છે. આ ગુનાની તપાસ પો.ઈ.શ્રી જે.એન.યાવડા ચલાવે છે.

ઘરફોડ ચોરી:-

સમાચાર યાદી નં.૨૦૬૭/૧૮

સોલા હાઇકોર્ટ : ગૌરવભાઈ શીરીષભાઈ પટેલ (રહે.શુકન ઝોરી વિશ્વાસ સીટી-૧૦ ની પાસે વોડાફોન ટાવરની પાછળ ગોતા) એ તા.૨૧/૧૦/૧૮ નારોજ સોલા હાઇકોર્ટ પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૧૧/૧૦/૨૦૧૮ રાતના ૧૦/૪૫ થી તા.૧૨/૧૦/૨૦૧૮ ના કલાક ૧૦/૦૦ સુધીના સમયગાળા દરમ્યાન પોતાના ઘરના દરવાજાનું તાળુ ખોલી, અજાણી વ્યક્તિ ઘરમાં પ્રવેશ કરી, સોનાના દાગીના કિંમત રૂપિયા ૩,૧૦,૦૦૦/- તથા રોકડ રૂપિયા ૫૦,૦૦૦/- મળી કુલ રૂપિયા ૩,૬૦,૦૦૦/- મતાની ચોરી કરી લઈ ગઈ છે. આ ગુનાની તપાસ પો.ઈ.શ્રી ડી.એચ.ગઢવી ચલાવે છે.

બાપુનગર : ભરતભાઈ ભલાભાઈ પટેલ (ઉ.વ.૪૧)(રહે. શિવદર્શન પાર્ક, જી.એસ.ટી. કોસીંગ પાસે, ન્યુ રાણીપ) એ તા.૨૧/૧૦/૧૮ નારોજ બાપુનગર પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૧૬/૧૦/૨૦૧૮ રાતના ૮/૦૦ થી તા.૧૭/૧૦/૨૦૧૮ ના કલાક ૧૦/૩૦ સુધીના સમયગાળા દરમ્યાન બાપુનગર ઇન્ડિયા કોલોની રોડ ઉપર આવેલ માતૃશક્તિ સોસાયટીની સામે “ઉમીયા ગાજ” નામના પોતાના કારખાના નો દરવાજા ડુપ્લીકેટ ચાવીથી ખોલી, અજાણી વ્યક્તિ કારખાનામાં પ્રવેશ કરી, કારખાનામાં પડેલ કોટન પેન્ટ નંગ- ૭૦ કુલ કિંમત રૂપિયા ૩૫,૦૦૦/- મત્તાના ચોરી કરી લઈ ગઈ છે. આ ગુનાની તપાસ પો.સ.ઈ.શ્રી એમ.એમ ગઢવી ચલાવે છે.

ચોરી:-

સમાચાર યાદી નં.૨૦૬૮/૧૮

શાહીબાગ : ડૉ.હસુમતીબહેન રણછોડલાલ પટેલ (ઉ.વ.૭૪)(રહે.નાની હમામની પોળ ઘી કાંટા કોર્ટની બાજુમાં શાહપુર) એ શાહીબાગ પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૨૦/૧૦/૧૮ બપોરના ૨/૦૦ વાગ્યાના સુમારે રીક્ષા ચાલક સહિત કુલ ચાર અજાણ્યા ઇસમો (૨૦ થી ૨૫ વર્ષના આશરા) એ ભેગામળી ડૉ.હસુમતીબહેન ને ઓટોરીક્ષામાં બેસાડી સિવિલ સર્કલ થી બળીયાલીમડી થઈ ગીરધરનગર સર્કલ થી એક પેસેંજર બેસાડી, ડૉ.હસુમતીબહેનની નજર ચુકવી ગળામાંથી સોનાની માળા કિંમત રૂપિયા ૪૫,૦૦૦/- ચોરી લઈ, ગીરધરનગર બ્રીજના ઉપરના ભાગે ડૉ.હસુમતીબહેન ને રીક્ષામાંથી ઉતારી દઈ ભાગી ગયા હતા. આ ગુનાની તપાસ પો.સ.ઈ.શ્રી વી.પી.મકવાણા ચલાવે છે.

દાઝી જતાં મૃત્યુ :-

સમાચાર યાદી નં.૨૦૬૯/૧૮

કૃષ્ણનગર : નરેશભાઈ પરષોતમભાઈ પંચાલ (ઉ.વ.૩૨)(રહે.બાલકૃષ્ણનગર સૈજપુર બોધા) તા.૧૬/૧૦/૧૮ ના રોજ ઘરે ચા ગરમ કરતા હતા દરમ્યાન ગેસની સગડી માં આગ લાગતા, શરીરે ગંભીર રીતે દાઝી જતાં સારવાર માટે તેમને સિવિલ હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. જ્યાં સારવાર દરમ્યાન તા.૨૦/૧૦/૧૮ રાતના ૯/૦૦ તેમનું મૃત્યુ નિપજ્યુ હતું. આ અંગે કૃષ્ણનગર પોલીસે અકસ્માત મોત નોંધી આ અંગેની તપાસ કૃષ્ણનગર પોલીસ ચલાવે છે.

નાયબ પોલીસ કમિશનર,
કંટ્રોલરૂમ, અ'વાદ શહેર.
પોલીસ કમિશનર વતી.